

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરી, બોટાદ

લોક દરબાર તારીખ : ૦૩.૦૪.૨૦૧૬ રવિવાર	સ્થળ : તાલુકા પંચાયત કચેરી, આયોજન હોલ, ઉમરાળા	સમય : બપોરે ૦૩.૦૦ કલાકે	તાલુકો : ઉમરાળા
-------------------------------------	--	-------------------------	-----------------

તા.૦૩.૦૪.૨૦૧૬ ના રોજ ઉમરાળા મૂકામે સરકારશ્રી દ્વારા યોજાનારા “લોક સંવાદ સેતુ - લોક દરબાર” અંતર્ગત રજુ થયેલ પ્રશ્ન/રજુઆતની વિગતો:

પ્રશ્ન નંબર	અરજદારશ્રી નું નામ	પ્રશ્નની ટુંકી વિગત	અમલીકરણ અધિકારી / ખાતાના વડાશ્રીનો પ્રશ્ન નિકાલ અંગેનો જવાબ	રીમાર્ક્સ
૩૩	શ્રી હેમંતભાઈ પી. ઢીલા, મુ. પરવાળા	ભ્રષ્ટાચાર બાબત.	શ્રી હેમંતભાઈ પી. ઢીલાની તા.૩૧.૦૭.૨૦૧૫ ની અધિક્ષક ઈજનેરશ્રી, પી.જી.વિ.સી.એલ., વર્તુળ કચેરી, બોટાદને સંબોધીને લખવામાં આવેલ ધોળા પે. વિ. કચેરીમાં થતી ગેરરીતી બાબતેની ફરિયાદ અન્વયે ક્ષેત્રીય કચેરી, ભાવનગર દ્વારા સક્ષમ અધિકારીથી ખાનગી રાહે તપાસ કરાવવામાં આવેલ જેનો તપાસણી અહેવાલ સક્ષમ અધિકારી દ્વારા ક્ષેત્રીય કચેરી, ભાવનગરને મોકલવામાં આવેલ છે. જેમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ કોઈ ગેરરીતી કે ભ્રષ્ટાચાર થયેલ હોવાનું જણાયેલ નથી.	નિકાલ
૩૪	શ્રી હેમંતભાઈ પી. ઢીલા, મુ. પરવાળા	પી.જી.વિ.સી.એલ. કંપનીના જવાબદાર અધિકારીઓ દ્વારા ગેરરીતીઓ થયેલ હોવા બાબત.	શ્રી હેમંતભાઈ પી. ઢીલાની તા.૩૧.૦૭.૨૦૧૫ ની અધિક્ષક ઈજનેરશ્રી, પી.જી.વિ.સી.એલ., વર્તુળ કચેરી, બોટાદને સંબોધીને લખવામાં આવેલ ધોળા પે. વિ. કચેરીના જવાબદાર અધિકારી દ્વારા ગેરરીતી થયેલ હોવા છતાં સાચી હકીકત દર્શાવવામાં આવતી નથી તેમજ અરજદારને ધમકીઓ નાચબ ઈજનેર, ધોળા દ્વારા આપવામાં આવે છે તે બાબતની ફરિયાદ અન્વયે ક્ષેત્રીય કચેરી, ભાવનગર દ્વારા સક્ષમ અધિકારીથી ખાનગી રાહે તપાસ કરાવવામાં આવેલ જેનો તપાસણી અહેવાલ સક્ષમ અધિકારી દ્વારા ક્ષેત્રીય કચેરી, ભાવનગરને મોકલવામાં આવેલ છે. જેમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ કોઈ ગેરરીતી કે ભ્રષ્ટાચાર થયેલ હોવાનું જણાયેલ નથી.	નિકાલ

પ્રશ્ન નંબર	અરજદારશ્રી નું નામ	પ્રશ્નની ટુંકી વિગત	અમલીકરણ અધિકારી / ખાતાના વડાશ્રીનો પ્રશ્ન નિકાલ અંગેનો જવાબ	રીમાર્કસ
૪૦	શ્રી રમેશચંદ્ર દલીચંદ શાહ, મું. ડેડકડી	વીજ કનેક્શન આપવા બાબત.	<p>શ્રી રમેશચંદ્ર દલીચંદભાઈ શાહએ તા.૨૦.૦૧.૨૦૧૬ નાં રોજ રૂા. ૪૦/- અરજી નોંધણી ફી ભરી મોજે- ડેડકડી, તા. ઉમરાળા ખાતે ઘર વપરાશનાં હેતુસર ધોળા પે. વિ. કચેરી ખાતે અરજી નોંધણી કરાવેલ છે. જેની સ્થળ મોજણી ધોળા પે. વિ. કચેરી દ્વારા કરવામાં આવતા માલુમ પડેલ છે કે રમેશચંદ્ર દલીચંદભાઈ શાહનાં મકાનના સામેના મકાનમાં શ્રી ગુણવંતરાય દેવીચંદ મહેતાનાં નામથી ઘર વપરાશનાં હેતુસર વીજ જોડાણ ૩૯૩૧૦/૦૦૦૨૭/૯ ગ્રાહક નંબર થી ચાલતું હતું પરંતુ સદર મકાન છેલ્લા પાંચ વર્ષથી બંધ હોવાનું જોવા મળેલ છે. શ્રી ગુણવંતરાય દેવીચંદ મહેતાનાં નામનું વીજ જોડાણનો વીજ ઉપયોગ રમેશચંદ્ર દલીચંદભાઈ શાહ કરતા હોવાનું તથા તા.૧૫.૦૧.૨૦૧૬ નાં રોજ વીજ ચેકિંગમાં આ વીજ જોડાણ ફરીથી વીજ ચેકિંગમાં ઝડપાયેલ જેની ચકાસણી શ્રી રમેશભાઈ દલીચંદભાઈ શાહની હાજરીમાં જ કરવામાં આવેલ પરંતુ રમેશભાઈ દલીચંદભાઈ શાહ દ્વારા ચેકિંગ ઓફિસરને ગેરમાર્ગે દોરીને વીજ ઉપયોગમાં શ્રી ગુણવંતરાય દેવીચંદ મહેતાનું નામ લખાવેલ છે.</p> <p>આમ, તેઓ અગાઉ વીજ ચોરીમાં ઝડપાયેલ હોય તેમજ સદર વીજ ચોરી પૂરવણી બીલણી રકમ આજ દિન સુધી ભરપાઈ કરેલ ન હોય જેથી સદર ઘર વપરાશનાં વીજ જોડાણની અરજી પરત્વે આગળની કાર્યવાહી હાથ ધરી શકાયેલ નથી.</p>	નિકાલ